



ડો. ટી.આર.અહલાવત
ઇ./યા.સંશોધન નિયામક

સંશોધન નિયામકશ્રીની કચેરી
નવસારી કૃષિ યુનિવર્સિટી
એરુ ચાર રસ્તા, નવસારી- ૩૯૬ ૪૫૦



વિકાસ ખર્ચ યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટના વપરાશ માટે
ધ્યાને રાખવાના જરૂરી મુદ્દાઓ બાબત...

વંચાણે: ૧. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ઠરાવ ક્રમાંક - નકવ-૧૨૨૦૨૨-૪૩૦-ક.૨
તા.૧૯.૦૪.૨૦૨૨

૨. હિસાબ નિયામકશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટીના પરિપત્ર ક્રમાંક - ૩૭૬૪/૨૦૨૨ તા.૧૩.૦૫.૨૦૨૨

-:: પરિપત્ર ::-

આથી સંબંધકર્તા સર્વેને જણાવવાનું કે, અત્રેની યુનિવર્સિટીમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણ અંતર્ગત વિકાસ ખર્ચ(પ્લાન) યોજનાઓ કાર્યરત છે જેમાં નામદાર રાજ્ય સરકારશ્રી દ્વારા યોજનાઓના હેતુઓને ધ્યાનમાં રાખીને જે તે નાણાકીય વર્ષમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. સદર ગ્રાન્ટના યોગ્ય વપરાશ માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાને રાખવાના રહેશે.

૧)	નામદાર સરકારશ્રી માંથી મળેલ ગ્રાન્ટ પગાર ભથ્થા, રિકરીંગ, નોન-રિકરીંગ અને બાંધકામ એમ જે સદરે ફાળવવામાં આવી હોય તે જ સદરે અને તે હેતુઓ માટે જ ખર્ચ કરવાનો રહેશે. અન્ય હેતુઓ માટે ખર્ચ કરી શકાશે નહિ.
૨)	જે તે નાણાકીય વર્ષ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટની મર્યાદામાં રહીને ચાર ક્વાર્ટરમાં સપ્રમાણ ખર્ચ થાય તે રીતે યોગ્ય વાર્ષિક આયોજન કરીને ખર્ચ કરવાનો રહેશે. આયોજનના અભાવે ફાળવેલ ગ્રાન્ટથી વધારે ખર્ચ થઈ ગયા પછી રિવ્યુ બેઠકમાં ગ્રાન્ટ મળી જ જશે તેવી અપેક્ષા રાખવી નહિ. તેમજ આ અંગે અત્રે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવણી માટે રજુઆતો કરવી નહિ.
૩)	જે તે વિકાસ ખર્ચ (પ્લાન) યોજનાઓની આવક તે જ વિકાસ ખર્ચ (પ્લાન)ના બજેટ સદર માં જ જમા કરાવવાની રહેશે. તેમજ વધુમાં વધુ આવક જમા થાય તેવા પ્રયાસો કરવાના રહેશે.
૪)	ક્લાસીફાઇડ વર્ક્સ (બ.સ..૧૨૬૦૦) તથા માઇનોર અને ઓરીજીનલ વર્ક્સ (બ.સ.૧૫૩૪) હેઠળ ફાળવેલ ગ્રાન્ટનો ખર્ચ જે તે નાણાકીય વર્ષની તારીખ ૩૧ ડીસેમ્બર સુધીમાં કરવાનો રહેશે.
૫)	Government e Marketplace (GeM) પોર્ટલ પર આઉટસોર્સિંગથી રોકવામાં આવતા ઈસમો માટે જે તે બજેટ સદરમાં વાર્ષિક નાણાકીય આયોજન મુજબ જોગવાઈ છે કે કેમ તે ધ્યાને લઈને પછી જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
૬)	બજેટ રજુ કરતી વખતે નવા સાધનોની ખરીદીના વિકલ્પે Rental Model, Outsourcing થી કે પછી અન્ય Hybrid model થી કામગીરી લઈ શકાય તેમ હોય તો તેનો તુલનાત્મક અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ મુજબ કામગીરી લેવાની રહેશે.
૭)	નાણા વિભાગના કરકસર પ્રભાગ દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી કરકસર અંગેની સૂચનાઓનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વધુમાં હિસાબ નિયામકશ્રીના વંચાણે લીધેલ પરિપત્ર-૨ મુજબની સુચનાઓનો પણ અમલ કરવાનો રહેશે.

જા.નં.નકૃયુ/સંનિ/આયોજન/૩૫૬૦-૬૧/૨૦૨૨
તા.૨૬.૦૫.૨૦૨૨

સંશોધન નિયામક અને
અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ

નકલ રવાના:

- માન. કુલપતિશ્રીના રહસ્ય સચિવશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી તરફ જાણ સારૂ.
- સંબંધિત કર્મચારીઓ/અધિકારીશ્રીના કચેરી વડા તરફ ઉક્ત બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા સારૂ.